

Date: 2nd June, 2022

To, BSE Limited PhirozeJeejeebhoy Tower, Dalal Street, Mumbai – 400001

Dear Sir/Ma'am,

Sub: Newspaper Advertisement of extract of Audited Financial Results for the Quarter and Year ended on 31st March, 2022

Ref: Security Id: MUNCAPM / Code: 511200

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has given Newspaper Advertisement on 1st June, 2022 of Audited Financial Result for the Quarter and Year ended on 31st March, 2022 in:

1. English Newspaper - Indian Express Newspaper and

2. Regional Language Newspaper (Gujarati) - Financial Express Newspaper

Kindly take the same on your record and oblige us.

Thanking You.

Yours Faithfully,

For, Munoth Capital Market Limited

Bhagyashree Jasmin Sutar Company Secretary *

Registered Office:

Board Line: +91-79-26937954 E-mail: info@munoth.com Website: www.munoth.com

ARDI INVESTMENT & TRADING COMPANY LIMITED

CIN: L65923MH1981PLC024912 Shop No. 3 Hemu Castle, Dadabhai Road, Near Gokhlibai School Vile Parle (W), Mumbai-400056, Maharashtra Email id: ardi.invest2013@yahoo.in

STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE HALF YEAR AND YEAR ENDED ON 31 (Rs. in Lacs **Quarter Ended** Year Ended 3 Month 3 Month 3 Month **Particulars** ended on ended on ended on Ended on Ended on 31.03.2021 31/03/2022 31/03/2021 31.03.2022 31.12.2021 Audited Unaudited Audited Audited Audited Total Income -41.66 0.61 103.69 -40.91 103.69 Net Profit for the year before tax -41.67 98.44 -51.73 98.26 2 -2.79Net Profit for the year after tax -48.94 -2.79 -51.73 3 89.44 89.26 Total Comprehensive Income for the year 5 Paid up Equity Share Capital 40 40 40 40 40 Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs. 10/- each) -12.24-0.7022.36 -12.9322.32 Diluted -12.24 -0.70 22.36 -12.93 22.32

Note:

a) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 30.05.2022.

b) The Audit is required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements Regulations, 2015 has bee completed by Auditors of the company.

c) The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the

SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available or the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com)

The figures for the previious year/periods are re-arranged/re-grouped, wherever cons e) The figures for the guarter ended 31st March, 2022 and guarter ended 31st March, 2021 are the balancing figures between the audited figures in respect of the full financial year and the published year to date figures up to the third quarter of the relevant financial year. For and on behalf of

Place: Ahmedabad Date: 30.05.2022

Ardi Investment and Trading Ltd Gautam Sheth Director (DIN:06748854)

KONNDOR INDUSTRIES LIMITED

CIN : L51100GJ1983PLC006041 Regd. Off: 201, Avdhesh House, Opp: Devang Park, Opp: Guru Govind Gurudwar S.G.Highway, Thaltej, Ahmedabad - 380054. Ph: 07940392344 Email: konndorind@gmail.com | Website: www.konndorindustries.com

Extract of Unaudited Finan for the Quarter ended 31st			Amount in Rs. Lakhs
Particulars	Quarter ended 31.03.2022 (Audited)	Year ended 31.03.2022 (Audited)	Year Ended 31/03/2021 (Audited)
Total Income from operations	87.61	375.17	911.94
Net Profit / (Loss) for the period (Before Tax Exceptional and/or Extraordinary Items)	33.90	84.47	4.23
Net Profit / (Loss) for the period before Tax (After Exceptional and/or Extraordinary Items)	33.90	84.47	4.23
Net Profit / (Loss) for the period after Tax (After Exceptional and/or Extraordinary Items)	19.60	59.30	2.31
Total Comprehensive Income for the period [Comprising Profit (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	0.18	0.18	2.57
Equity Share Capital	550.4	550.4	550.4
Reserve (excluding Revaluation Reserve) as shownin the Audited Balance Sheet of the	000.4	330.4	330.4
previous year	276.51	276.51	217.03
Earnings Per Share (of Rs.10/- each) (Not Annualised)			
1. Basic	0.36	1.08	0.04
2. Diluted	0.36	1.08	0.04

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites viz. www.bseindia.com and also on the Company's website www.konndorindustries.com For Konndor Industries Limited

Date: 30/05/2022 Shashikant Thakar Place: Ahmedabad Director (Din: 02887471)



Ended 31 March 2022

Samrat Pharmachem Limited Regd Office: Plot No. A2/3445, GIDC, Phase 4, Ankleshwar - 393 002, Gujarat (Website: www.samratpharmachem.com) Corp Office : 701/702 Business Square, M. A. Road, Andheri (West), Mumbai - 400 058 (CIN: L24230GJ1992PLC017820)

(Rs. In Lakhs except earnings per share)

1		to. III Luttio except t	surmings per snare,
	Particulars	Year Ended 31-Mar-2022	Year Ended 31-Mar-2021
1	Total Income from operations	22236.25	17948.06
2	Profit before exceptional	2362.49	736.15
1	items and tax		
3	Profit before tax	2360.15	734.38
4	Tax expense	-641.66	-201.07
5	Profit after tax	1718.49	533.31
6	Paid up equity capital	308.97	308.97
7	Earnings per share		
	Basic	55.62	17.26
	Diluted	55.62	17.26

- The above results were reviewed by the Audit Committee of the Board of Directors. The above results have been taken on record by the Board of Directors at it Meeting held on Monday, 30 May 2022 at the Corporate Office of the Company.
- The figures of the quarter ended 31 Mar 2022 and 31 Mar 2021 are the balancing figures between the audited figures in respect of full financial years and the published (unaudited) up to the third quarter of relevant financial year. The Board of Directors has recommeded dividend of Re. 1/- per fully paid equity share
- of Rs. 10/- each (10%) for the financial year ended 31 March, 2022, subject to approval of the members at the ensuing Annual General Meeting of the Company
- The Company manufactures phamaceutical chemicals, which is a single business

By order of the Board of Directors

Place:Mumbai

For Samrat Pharmachem Limited Raiesh Mehta Date :30 May 2022 **Executive Director**

MUNOTH CAPITAL MARKET LIMITED

CIN: L99999GJ1986PLC083614

Read, Office: Shanti Nivas, Opp. Shapath-V. Mr. Karnavati Club, S G Road, Ahmedabad-380058 E-mail address: munoth@gmail.com; Contact No.: 022-22843144, 22870278, 26937954 Audited Standalone financial results for the quarter and year ended 31 March 2022 prepared in accordance with the Indian Accouting Standard (Ind-AS)

Ex	Extract of Audited Financial Results for the Quarter/ Year ended 31/03/2022				
			(Rs. In Lakhs	except EPS)	
Sr. No.	Particulars	Quarter Ending on 31.03.2022	Year to Date Figures 31.03.2022	Corresponding Three Months Ended in the Previous Year 31.03.2021	
1	Total income from operations (net)	9.40	33.34	2.85	
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	3.55	13.49	-0.54	
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	3.55	13.49	-0.54	
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	3.55	13.49	-0.51	
5	Total Comprehensive income for the period (Comprising Profit for the period (after Tax) and other Comprehensive income (after Tax)	4.56	16.01	2.71	
6	Equity Share Capital	449.55	449.55	449.55	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year)	0.00	0.00	0.00	
8	Face Value Of Equity Share Capital	5/-	5/-	5/-	
9	Earnings Per Share (before and after extraordinary items) Basic / Diluted:	0.04	0.15	-0.01	

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure ments) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and company website

For, Munoth Capital Market Limited Date: 30-05-2022 Shantilal M Jain Place: Ahmedabad

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contants. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals adversing in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.



AARVEE DENIMS AND EXPORTS LIMITED

Regd. Office: 191, Shahwadi, Nr. Old Octroi Naka, Narol-Sarkhej Highway, Narol, Ahmedabad-382 405. CIN NO: L17110GJ1988PLC010504 | Website: www.aarvee-denims.com | Email ID: info@aarvee-denims.com | Phone No: 079-30417000 | Fax No: 079-30417070

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2022

(₹ in Lakhs except for EPS)

		Standalone				
Sr	Particulars	Q	UARTER ENDE	YEAR ENDED		
No.		MARCH 31, 2022	DEC 31, 2021	MARCH 31, 2021	MARCH 31, 2022	MARCH 31, 2021
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)
1	Total income from operation	11418.11	11866.25	13996.78	43955.53	28732.19
2	Net Profit/(Loss) for the period before tax and exceptional items	(1,485.57)	(1,833.25)	(3,331.59)	(6,345.01)	(8,307.97)
3	Net Profit/(Loss) for the period before tax and after exceptional items	(1,485.57)	(1,833.25)	(3,331.59)	(6,345.01)	(8,307.97)
4	Net Profit/(Loss) for the period after tax (after extra exceptional items)	(1,217.68)	(1,402.93)	(2,191.15)	(4,142.27)	(6,419.11)
5	Equity share capital	2345.98	2345.98	2345.98	2345.98	2345.98
6	Total Comprehensive Income for the period [Comprising profit/(Loss) for the period after tax) and other Comprehensive income (after tax)]	12.59	-	83.80	12.59	83.80
7	Reserves including Revaluation Reserve as shown in the audited balance sheet of the previous year	-	-	-	10287.61	14417.31
8	Earnings per share (before and after extra ordinary items) (of Rs. 10/- each) Not Annualised Basic and Diluted	(5.19)	(5.98)	(9.34)	(17.66)	(27.36)

NOTE:

- The above financial results have been reviewed by the Audit Committee and subsequently have been taken on record by the Board of Directors at its meeting held on May 30, 2022. The above financial results for the year ended March 31, 2022 were audited by the statutory auditors of the company, who have issued an unqualifie reports thereon. The statutory auditor has expressed an un-modified opinion on these financial results.
- The above is an abstract of the detailed format of quarterly and year ended financial results filed with Stock exchnage under Regulation 33 of SEBI (LODR) Regulations, 2015. The full format of the audited financial results of the company for the quarter/year ended March 31, 2022 are available on the company ny's website www.aarveedenims.com or on www.bseindia.com and www.nseindia.com of the website of Bombay Stock Exchange ('BSE') and National Stock Exchange ('NSE') respectively.

Place: Ahmedabad Date: 30th May 2022

For, Aarvee Denims and Exports Limited Vinod P. Arora Chairman and Managing Director (DIN: 00007065)

Nation Resolves To Ensure Benefits Of All Schemes Reach 100% Women





- More than 11.5 crore toilets made life easier for women
- More than 9.5 crore households got tap water connections
- 68% beneficiaries of MUDRA scheme are women
- 9.17 crore gas connections for women under Ujjwala Yojana
- Financial assistance to over 2.4 crore pregnant women and lactating mothers under PM Matru Vandana Yojana
- 3.11 crore free antenatal check-ups conducted under PM Surakshit Matritva Abhiyan
- Paid maternity leave increased from 12 weeks to 26 weeks
- 2.73 crore Sukanya Samriddhi Yojana accounts opened
- Practice of Triple Talaq abolished
- Permanent commission for women in Armed forces



Today, the priority of the country is on improving the lives of women. We are putting emphasis on lessening the difficulties of our mothers and sisters and ensuring their full participation in the development journey of India. - Narendra Modi -



davp 22201/13/0026/2223





ક્રમ નં.	દેણદાર અને ગીરોદારના નામ અને શાખા	મિલકતોની વિગતો	બાકી રકમના લેણાં	સિક્યોર્ડ ક્રેડીટરની જાણમાં હોય તેવા કરબોજ	રીઝર્વ કિંમત	(૧) ઈએમડી (૨) બીડ વધારવાની રકમ	અધિકૃત અધિકારી નું નામ, સંપર્ક નં. /ઈ-મેલ
20.	શ્રી ચેતનકુમાર વાડીલાલ પટેલ (કરજદાર) ઉમિયા માતા મંદિર સામે, બસ સ્ટેન્ડ પાછળ, પોસ્ટ ઓફિસ - કનસા, વિસનગર, મહેસાણા - ૩૮૪૩૨૦. રબારી જલ્પાબેન મગનજીભાઈ (જામીનદાર) એ/૨૫, કૃષ્ણનગર સોસાયટી, ધરોઈ કોલોની રોડ, વિસનગર - ૩૮૪૩૧૫. યુનિયન બેંક ઑફ ઇન્ડિયા (વિસનગર-૨)	રહેણાંક ઘર રેવેન્થુ સર્વે નં. રખ૯૦ પૈકી, પ્લોટ નં. ૨૫/એ, બિલ્ટ અપ એરિયા ૩૦.૩૬.૩૦ સ્કે. મીટર્સ કુલ, ગામ વિસનગર, વિસનગર તાલુકા અંતર્ગત, જીક્ષોઃ વિસનગર, ગુજરાત માં આવેલ જે સુશ્રી રબારી જલ્પાબેન મગનજીભાઈની માલીકી. ચતુરસીમા : ટાઈટલ કીક મુજબ : પૂર્વઃ દરજી પ્રદીપભાઈ લાલજીભાઈનું ઘર, પશ્ચિમઃ પ્રજાપતિ પ્રહલાભાઈ મકતલાલનું ઘર, ઉત્તરઃ ખૂઘી જમીન, દક્ષિણઃ ગોગા મહારાજનું મંદિર. વાસ્તવિક મુજબઃ પૂર્વઃ દરજી પ્રદીપભાઈ લાલજીભાઈનું ઘર, પશ્ચિમઃ પ્રજાપતિ પ્રહલાભાઈ મકતલાલનું ઘર, હત્તરઃ આર્ગે સ્ટિક્શાઃ ગોગા મહારાજનું મંદિર.	Rs 16,80,266,.92 (તા. ૧૮.૦૬ ૨૦૨૧ ની કિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્ચોર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાકેતિક કબજો	15,18,000.00	(i) 1,52,000.00 (ii) Rs. 10,000.00	મો. સાદાબ હલીમ (ચીક મેનેજર) મો. 7069317167
	ઠાકોર જસવંતજી સોવનજી રહેણાંકઃ સ્હય∕હ, વલમ, વિસનગર, મહેસાણા - ૩૮૪૩૧૦. (અરજદાર) ઠાકોર કનુજી કેશાજી રહેણાંકઃ અથમાનો વાસ સ્હય, વાલમ, તાલુકા વિસનગર - ૩૮૪૩૧૦ (જામીનદાર) યુનિયન બેંક ઑફ ઇન્ડિયા (વિસનગર - ૨)	ગ્રામ પંચાયત આકરણી નં. ૫૧૬/૪, અથમાનો ઠાકોરવાસ બંધુ રોડ, ગામ વાતમ તાલુકા વિસનગર જીક્ષો મહેસાણા, ક્ષેત્રફળ ૯૯.૬૫.૮૬ સ્કે. મીટર્સ ની રહેણાંક મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે મિલકતની ચતુરસીમાઃ પૂર્વઃ પબ્લિક રસ્તો, પશ્ચિમઃ ઠાકોર ઈશ્વરજી ની ઘર, ઉત્તરઃ પબ્લિક રસ્તો, દક્ષિણઃ વાલમ બંધુ રોડ	Rs 2,73,624.00 (તા. ૦૨.૦૨.૨૦૨૧ ની ડિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્યોર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	10,97,000	(i) 1,10,000 (ii) Rs. 10,000.00	મો. સાદાબ હતીમ (ચીક મેનેજર) મો. 7069317167
22.	મિસ્ત્રી પ્રણવકુમાર વસંતકુમાર (કરજદાર) ૪૬, ગુલાબ પાર્ક, કંસા બીનખેતી તહેસીલ વિસનગર - ૩૮૪૩૧૫ મિસ્ત્રી વસંતકુમાર મનહરલાલ (જામીનદાર) ૪૬, ગુલાબ પાર્ક, કંસા બીનખેતી તહેસીલ વિસનગર - ૩૮૪૩૧૫ યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (વિસનગર - ૨)	બધી મિલકત રેવેન્ચુ સર્વે નં. ૪૬૯, પ્લોટ નં. ૨૧/બી (સી.એસ. નં. ૩૧૧૫/બી/૪૬) બિલ્ટ અપ અને માર્જીન એરિયા ૧૨૫.૫૮.૩૪ , ગુલાબ પાર્ક બંગલો, કંસા ગામ સીમા, તાલુકા વિસનગર, જીક્ષોઃ મહેસાણા.	Rs 8,90,800.74 (તા. ૦૧.૦૧.૨૦૧૯ ની ડિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્ચેર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	34,62,000	(i) 3,47,000.00 (ii) Rs. 10,000.00	મો. સાદાબ હલીમ (ચીફ મેગેજર) મો. 7069317167
23.	પઠાણ રાજુખાન નત્રહેખાન, હ-૮, ગુલીસ્તાન પાર્ક સોસાયટી, સિદ્ધપુર, જીકો પાટણ, ગુજરાત - ૩૮૪૧૭૫ (અરજદાર) પઠાણ મહેલકાબાનું રાજુખાન, હ-૮, ગુલીસ્તાન પાર્ક સોસાયટી, સિદ્ધપુર, જીકો પાટણ, ગુજરાત - ૩૮૪૧૭૫ (સહ-અરજદાર) યુનિયન બેંક ઑફ ઇન્કિયા (સિદ્ધપુર - ૨)	દુકાન નં. ૮७ (કોક્યુમેન્ટ મુજબ) / દુકાન નં. ૧૪૪ (સાઈટ મુજબ), ક્ષેત્રફળ ૧૬.૧૮ સ્કે.મીટર્સ, રેવેન્યુ સર્વે નં. ૧૨૨ પી-૨, સમર્થ કોમ્પ્લેક્ષ પાસે, હાઈવે રોડ પાસે, સિદ્ધપુર જીક્ષો પાટણ ની મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે	Rs 5,16,813.52 (તા. ૦૮.૦૭.૨૦૧૯ ની ડિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્ચેર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	11,32,000.00	(i) 1,14,000.00 (ii) Rs. 10,000.00	શ્રી સંદીપકુમાર પ્રભાકર પવાર (ચીફ મેગેજર) મો. 9860887718
24.	ફેમસ કેરી, પ્રોપરાઈટર - શ્રી પટેલ ભરતકુમાર કાન્તિલાલ, ૬, જરી કોમ્પ્વેસ, સિહપુર - ૩૮૪૧૫૧ શ્રી પટેલ દિનેશકુમાર કોન્તિલાલ, પટેલ પુ, તાલુકા વાડીયા, સિદ્ધપુર - ૩૮૪૧૫૧ યુનિયન બેંક ઑફ ઇન્ડિયા (સિદ્ધપુર -૨)	રહેણાંક ઘર, રેવેન્ચુ સર્વે નં. ૮/૧, તેવાડીયા સીમ, પ્લોટ નં. ૮, ગ્રામ પંચાયત મિલકત નં. ૫/૮, મહાકાલી પેરુ અને પોસ્ટ તેવાડીયા, તાલુકા સિદ્ધપુર જીદ્ધો પાટણ, ગુજરાત - ૩૮૪૧૫૧. માલીકઃ શ્રી દિન્નેશકુમાર કાન્તિલાલ પટેલ. ઉત્તરબાજુઃ અંદરનો રોડ, દક્ષિણબાજુઃ માર્જીન જમીન, પૂર્વબાજુઃ જોડાયેલ પ્લોટ નં. ૯, પશ્ચિમઃ જોડાયેલ પ્લોટનં. હ	Rs 5,17,302.00 (તા. ૧૨.૦૫.૨૦૧૮ ની કિમાન્ડ નોટીસ મુજબ સાથૈ સિક્ચોર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	12,80,000.00	(i) 1,28,000.00 (ii) Rs. 10,000.00	શ્રી સંદીપકુમાર પ્રભાકર પવાર (ચીફ મેનેજર) મો. 9860887718
25.	સોની મુકુન્દકુમાર નરોત્તમ ૩-૪૩ પટેલ પરુ, ગામ - તવાડીયા, તાલુકા સિદ્ધપુર - ૩૮૪૧૫૧ (અરજદાર) સોની રંજનબેન મુકુન્દભાઈ, ૩-૪૩ પટેલ પરુ, ગામ - તવાડીયા, તાલુકા સિદ્ધપુર - ૩૮૪૧૫૧ (સહ-અરજદાર) યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (સિદ્ધપુર - ૨)	રહેણાંક ઘર રેવેન્ચુ સર્વે નં. ૩૨૩ પૈકી-૧ / પૈકી-૨/પૈકી-૨ , પ્લોટ નં. ૨૯, ગામ તવાડીચા તાલુકા સિદ્ધપુર જીક્ષો પાટણ, ગુજરાત - ૩૮૪૧૫૧, ક્ષેત્રફળ ક૨.૬૫ સ્કે. મીટર્સ ની રહેણાંક મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે. મિલકતની ચતુરસીમાઃ પૂર્વઃ ૨૦ કુટ રોક, પશ્ચિમઃ ૨૦ કુટ રોક, ઉત્તરઃ પ્લોટ નં. ૨૮, દક્ષિણઃ પ્લોટ નં. ૩૦	Rs 1,09,398.49 (તા. ૦૪.૦૫.૨૦૧૯ ની કિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્ચોર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાકેતિક કબજો	10,11,000	(i) 1,02,000 (ii) Rs. 10,000.00	શ્રી સંદીપકુમાર પ્રભાકર પવાર (ચીક મેનેજર) મો. 9860887718
26.	મેસર્સ રામદેવ ટ્રેકીંગ કંપની, પ્રોપ. રજનીકાન્ત ફરીભાઈ પટેલ (એપ્લીકાન્ટ) દુકાન નં. ક, ગોપાલ કોમ્પ્લેસ, જૂનગંજ, પાટણ - ૩૮૪૨૬૫ પટેલ ફરીભાઈ કાલીદાસ (જામીનદાર) પટેલવાસ ગામ આદિત્ય, તાલુકા ફારીજ, જીક્ષો પાટણ યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (પાટણ-૨)	મિલકત નં. ૨૮७, ક્ષેત્રફળ ૧૮*૬૯=૧૨૪૨ સ્કે. કુટ, પટેલ વાસ ગામ આદિત્ય, તાલુકા હારીજ, જીક્ષો પાટણ ની મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે પૂર્વઃ પટેલ પ્રિતામ્બર નગરદાસની મિલકત પશ્ચિમઃ રોડ, ઉત્તરઃ દરજી પિતામ્બર મણીલાલ શંકરભાઈની મિલકત દક્ષિણઃ પટેલ બાબુલાલ મધુભાઈની મિલકત	Rs 14,13,460.88 (તા. ૦૧.૦૪.૨૦૨૧ ની કિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્ચેર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	13,37,000	(i) 1,34,000 (ii) Rs. 10,000.00	ઉદય નારાયણ (ચીફ મેનેજર) મો. 9408212984
27.			Rs 19,04,412.20 (તા. ૧૩.૦૪.૨૦૨૧ ની કિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્ચોર કેકીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	13,00,000	(i) 1,30,000 (ii) Rs. 10,000.00	ઉદય નારાચણ (ચીક મેનેજર) મો. <mark>9408212984</mark>
28.	કુલાભાઈ અમૃતભાઈ દેસાઈ (અરજદાર) સરનાયું: ૨૪, સંદેસરપતિ સીમા પાટણ, અંબાકૃપા સોસાયટી, મોતીસા દરવાજા, સાંઈ બાબા મંદિર પાસે, પાટણ. પ્રવિભાયંદ નરસિંહભાઈ પંચોલી (જામીનદાર) સરનાયું: એ/૩૯, હસ્તીનાપુર ફલેટ, રેતીયત નગર, પાટણ - ૩૮૪૨૬૫. યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (પાટણ)	પ્લોટ નં. ૨૪, રેવેન્યુ સર્વે નં. ૬७૦ પૈકી સી એસ નં. 3030/૨૫, ખોડિયાર હાઉસીંગ સોસાયટી તાલુકા અને જીક્ષો પાટણ. ક્ષેત્રફળ ૬૯.૬૦ સ્કે. મીટર્સ ની અચલિત મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે. મિલકતની ચતુરસીમાઃ પૂર્વઃ કોમન પ્લોટ, પશ્ચિમઃ અંદરનો રોડ, ઉત્તરઃ પ્લોટ નં. ૨૫, દક્ષિણઃ રોડ	Rs 4,95,629.80 (તા. ૧૩.૦૪.૨૦૨૧ ની કિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્ચોર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	14,49,000.00	(i) 1,45,000.00 (ii) Rs. 10,000.00	ઉદય નારાથણ (ચીફ મેનેજર) મો. 9408212984
29.	મેસર્સ વારાહી કન્સ્ટ્રકશન કંપની - પોસ્ટ - જેતલવાસણા, વિસનગર, મહેસાણા શ્રી અમૃતભાઈ નાનજીભાઈ પટેલ (પ્રોપરાઈટર), હાઉસ નં. ૨/૨૮, ગ્રામ પંચાયત, અનુકસમ નં. ૪૩૯, જેતલવાસણા, વિસનગર, મહેસાણા પટેલ હસુમતીબેન સંજ્યકુમાર (જામીનદાર), ૫-૯, જેતલવાસણા, વિસનગર, મહેસાણા. યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (મહેસાણા - ૨)	ગ્રામ પંચાયત ઘર નં. ૨/૨૮, ગ્રામ પંચાયત અનુક્રમ નં. ૪૩૯, ગામ - જેતલવાસણા, તાલુકા - વિસનગર, જીક્ષો : મહેસાણા, ક્ષેત્રફળ ૮૨૫.૦૦ સ્કે. કુટ ની મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે ચતુરસીમા : પૂર્વ: પરષોત્તમભાઈ મન્છારામની ઘરની દિવાલ, પશ્ચિમ: જચંતિભાઈ બાબાભાઈની ઘરની દિવાલ, ઉત્તર: મહોલાનો રસ્તો, દક્ષિણ: રાવળવાસ	Rs 1,83,739.00 (તા. ૧૯.૦૬.૨૦૨૧ ની કિમાન્ક નૌટીસ મુજબ સાથે સિક્ચોર ક્રેકીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	13,08,000	(i) 1,31,000 (ii) Rs. 10,000.00	મોર્ટમદ શાદાબ દલીમ (ચીફ મેનેજર) મો. 7069317167
	30. મેસર્સ પ્રમુખ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, રજૂકર્તા ભાગીદારો : 1. શ્રી કનુભાઈ મનાભાઈ ચોંધરી, 2. શ્રી ભરતકુમાર જીવનભાઈ ચોંધરી, 3. શ્રીમતી ચોંધરી સવિતા ભરતું કમાર, સવેં નં. ૪૫૯, રાધા સ્વાગી સતસંગ બાયસ પીલવાઈ, વિજાપુર, મહેસાણા - ૩૮૨૮૫૦. જામીનદારો : 1. શ્રી કનુભાઈ મનાભાઈ ચોંધરી, 30, ચોંધરીવાસ ભીમપુરા, માણસા, ગાંધીનગર - ૩૮૨૮૪૫. 2. શ્રી ભરતકુમાર જીવનભાઈ ચોંધરી, રહેણાંક : ૪૨, ટાંકીવાળો, ચોંધરીવાસ, અમજા ૧, કલોલ, ગાંધીનગર - ૩૮૨૫૫. 3. શ્રીમતી ચોંધરી સવિતા ભરતકુમાર, રહેણાંક : ૪૨, ટાંકીવાળો, ચોંધરીવાસ, અમજા ૧, કલોલ, ગાંધીનગર - ૩૮૨૫૫. શ્રુભિયન બેંક ઑફ ઈન્ડિયા (વિજાપુર-૨)		Rs 1,55,43,913.07/- (તા. ૦૧.૦૪.૨૦૨૧ ની કિમાન્ડ નોટીસ મુજબ સાથે સિકથીર ક્રેડીસ્ટ નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	1,80,00,000	(i) 18,00,000 (ii) Rs. 10,000.00	મોહંમદ શાદાબ હતીમ (ચીફ મેનેજર) મો. 7069317167
31.	રાજાભાઈએ અબ્રાહમભાઈસુમારા ૧૬૯, પમરુ, પોસ્ટ જેરઠા, તાલુકા કિસા, જીક્ષોઃ બનાસકાંઠા (અરજદાર) નિરુબેન રાજાભાઈસુમારા ૧૬૯, પમરુ, પોસ્ટ જેરઠા, તાલુકા કિસા, જીક્ષોઃ બનાસકાંઠા (સદ-અરજદાર) યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (ડિસા - ૨)	પ્લોટ નં. ૧૦૩, ક્ષેત્રફળ ૧૧૧.૫૨ રકે. મીટર્સ, બીનખેતી જમીન સર્વે નં. ૧૫७ પૈકી, પમંડુ પોસ્ટ જેરઠા, તાલુકા કિસા જીક્ષો બનાસકાંઠા ની રહેણાંક મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે મિલકતની ચતુરસીમાઃ પૂર્વઃ કરસનભાઈ ધરમભાઈની મિલકત, પશ્ચિમઃ રસ્તો, ઉત્તરઃ વલીભાઈ ઈબ્રાહીમભાઈ ની મિલકત, દક્ષિણઃ મગનજી ચેટરજીની મિલકત	Rs 6,11,601.48 (તા. ૨૮.૧૧.૨૦૧૮ ની કિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્ચોર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	7,30,000	(i) 73,000 (ii) Rs.10,000.00	શ્રી સારક છોટરી (ચીફ મેનેજર) મો. 6205963833
32.	. બળવંતસિંહ બાબુસિંહ પરમાર (અરજદાર) સરનામું: બેરણા, હિંમતનગર, જીહોઃ સાબરકાંઠા - ૩૮૩૦૦૧ કેશવલાત જેઠાભાઈ વણકર (જામીનદાર) સરનામું: બેરણા, હિંમતનગર, જીહોઃ સાબરકાંઠા - ૩૮૩૦૦૧ સ્સમુખલાલ શામળદાસ પટેલ (જામીનદાર) સરનામું: પક, આદર્શ બંગલો, શરણમ સોસાયટી પાસે, મેડીકલ રોડ, મોતીપુરા, હિંમતનગર, જીહોઃ સાબરકાંઠા - ૩૮૩૦૦૧ શુનિયનગર, જીહોઃ સાબરકાંઠા - ૩૮૩૦૦૧ શુનિયનગર, જીહોઃ સાબરકાંઠા - ૩૮૩૦૦૧		Rs 8,12,035.76 (તા. ૧૫.૦૪.૨૦૨૧ ની કિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્ચોર કેકીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	26,63,000.00	(i) 2,67,000.00 (ii) Rs. 10,000.00	શ્રી જી. એસ. ટોલીચા (ચીફ મેનેજર) મો. 8572889627
33.	મેસર્સ શીવમ પેઈન્ટસ એન્ડ હાર્ડવેર, રજૂકર્તા શ્રી બીપીનચંદ્ર શાંતિલાલ જોધી, સરનામું: મીના બજાર સ્ટ્રીટ, મહેતા માર્કેટ, સુરેન્દ્રનગર, ગુજરાત યુનિયન બેંક ઑફ ઇન્ડિયા (સુરેન્દ્રનગર- ૨)	રહેણાંક કલેટ નં. 30૪, ત્રીજો માળ, સી.એસ. નં. ૪૯૧૫ પૈકી, સી.એસ. વોર્ડ નં. ૨, અજરામર એપાર્દમેન્ટ સ્વસ્તિક ચાર રસ્તા, પવન બંગલોઝ સામે, સુરેન્દ્રનગર. શ્રી બીપીનચંદ્ર શાંતિલાલ જોષીની માલીકી. ચતુરસીમાઃ પૂર્વઃ તેની ડાયરેક્શન માં રોડ અને પછી રત્નસાગર ફલેટ૧ સ, પશ્ચિમઃ તેની ડાયરેક્શન માં ભરત સોસાયટીનું ઘર, ઉત્તરઃ તેની ડાયરેક્શન માં ૫૦ ફુટ પબ્લિક રોડ, દક્ષિણઃ તેની ડાયરેક્શન માં અશોકનગર સોસાયટી ની મિલકત.	Rs 12,18,998.24/- (તા. ૦૫.૦૪.૨૦૨૧ ની કિમાન્ક નોટીસ મુજબ સાથે સિક્ચોર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાકેતિક કબજો	19,43,000	(i) 1,95,000 (ii) Rs. 10,000.00	ઉદય નારાચણ (ચીફ મેનેજર) મો. 9408212984
	ગતુરભાઈ ઇશ્વરભાઈ પટેલ મલાક, તાલુકા - વઢવાણ, જીક્ષોઃ સુરેન્દ્રનગર યુનિયન બેંક ઑફ ઇન્ડિયા (સુરેન્દ્રનગર)	રેવેન્યુ સર્વે નં. ૪૫/૪ પૈકી, પ્લોટ નં. ૧૦૩, ગ્રામ પંચાયતની સીમા રતનપુર બાય પાસ રોડ તાલુકા વઢવાણ જીકોઃ સુરેન્દ્રનગર, ક્ષેત્રફળ ૮૩.૬૬ સ્કે.મીટર્સ ની રહેણાંક મિલકતના બધા ભાગ અને દિસ્સા સાથે. મિલકતની ચતુરસીમાઃ પૂર્વઃ ૫.૧૮ મીટર અને તે દિશામાં ખેતી જમીન સર્વે નં. ૪૩/૧, પશ્ચિમઃ ૫.૧૮ મીટર અને તે દિશામાં હ.૫૦ મીટર પહોળો રોડ, ઉત્તરઃ ૧૬.૧૫ મીટર અને તે દિશામાં પ્લોટ નં. ૧૦૨ની જમીન, દક્ષિણઃ ૧૬.૧૫ મીટર અને તે દિશામાં પ્લોટ નં. ૧૦૪ ની જમીન	Rs 2,18,332.82 (તા. ૦ષ.૦૪.૨૦૨૧ ની કિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્ચોર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો		(i) 2,08,000.00 (ii) Rs.10,000.00	ઉદચ નારાચણ (ચીફ મેનેજર) મો. 9408212984
35.	મેસર્સ મનન એન્ટરપ્રાઇઝ (પ્રોપ થોગેશ એચ પટેલ), દુકાન નં. ૨૬, ત્રાંબક ચેમ્બર્સ, મહેતા માર્કેટ, બેંક ઑફ ઇન્ડિયા પાસે, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧ જામીનદારો: ૧. ધનશ્યામભાઈ ધમરશીભાઈ પટેલ, રહેણાંક: સેજકપર, મોજીદાદ, તાલુકા - ચોડા, જીલો: સુરેન્દ્રનગર - ૩૬૩૪૧૦ ૨. ભગવાનભાઈ રવજીભાઈ ગોલાણી (પટેલ), રહેણાંક: પીકપ, પટેલ સોસાયટી, માંડવરાયજી સોસાયટી, રતનપુર, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦. ૩. ગીતાબેન અમરીતભાઈ વનેછા, રહેણાંક: ૬૫, કોળીવાસ, દરબાર શેરી, ગામ - આનંદપુર, તાલુકા - લીંબડી, જીલો: સુરેન્દ્રનગર સુરીન્દ્રનગર સ્ટુનિયન બેંક ઑફ ઇન્ડિયા (સુરેન્દ્રનગર - ૨)	ઈજીએમ રહેણાંક પ્લોટસ , બીનખેતી જમીન રતનપુર રેવેન્યુ સર્વે નં. ૪૪/પી૧ પૈકી, પ્લોટ નં. ૩૮ પૈકી પશ્ચિમ બાજુ જમીન ક્ષેત્રફળ ૧૦૯.૫૦ રકે.મીટર્સ રહેણાંક હેતુ સુરેન્દ્રનગરાની સીમા દૂધરેજ નગરપાલિકા, રતનપુર નામે જાણીતું સ્થળ, તાલુકાઃ વઢવાણ, જીહ્યોઃ સુરેન્દ્રનગર જે શ્રીમતી ગીતાબેન અમૃતભાઈ વનેછાની માલીકી. સદર મિલકતની ચતુરસીમા આ મુજબ છેઃ ઉત્તરબાજુઃ તે દિશામાં ૦૬.૫૫ મીટર્સ પ્લોટ નં. ૪૨ ની જમીન, દક્ષિણબાજુઃ તે દિશામાં ૦૮.૦૫ પહોળો રોઠ મીટર્સ ૯.૦૦ મીટર્સ, પૂર્વબાજુઃ ૧૫.૦૦ મીટર્સ તે દિશામાં પ્લોટની જમીન નં. ૩૮/પી, પશ્ચિમબાજુઃ ૧૫.૦૦ મીટર્સ તે દિશામાં રેવેન્યુ સર્વે નં. ૪૫/૨ પૈકી ની જમીન	Rs 68,64,821.36 (તા. ૦૪.૦૧.૨૦૨૦ ની કિમાન્ડ નોટીસ મુજબ સાથે સિક્ચોર ક્રેડીટર નું લેવાનું થતું આગળનું કરાર દરે વ્યાજ)	NIL સાંકેતિક કબજો	14,23,000.00	(i) 1,43,000.00 (ii) Rs. 10,000.00	ઉદય ગારાયણ (ચીફ મેનેજર) મો. 9408212984

ઈ-હરાજી વેચાણમાં ભાગ લેવા માટે, ઇચ્છુક બીડરોએ તેમની વિગતો સર્વિસ પ્રોવાઇડર વહેલી તકે https://mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp ને નોંધાવી દેવી અને યુઝર આઇડી તથા પાસવર્ડ મેળવી લેવાના રહેશે. ઇચ્છુક બીડરોને સલાહ છે કે સર્વિસ પ્રોવાઇડર પાસેથી મળ્યા પછી માત્ર પાસવર્ડ તરત બદલી નાંખવો. બીડર https://www.ibapi.in જોઈ શકે છે જ્યાં બીડરો માટે શૈક્ષણિક વિડીયો સાથે માર્ગદર્શન સંહિતા ઉપલબ્ધ છે. બીડરોએ નીચેની ઓપચારિકતાઓ વહેલી તકે પૂરી કરવાની રહેશે. પગહું ૧: ઈ હરાજી પ્લેટફોર્મ પર પોતાનો મોબાઇલ નંબર અને ઈમેઇલ આઇડીનો ઉપયોગ કરીને બીડરે રજિસ્ટ્રેશન કરાવવું. પગહું ૨: કેવાયસી વેરિફિકેશનઃ બીડરે જરૂરી કેવાયસી દસ્તાવેજો અપલોડ કરવા. એ ઈ-હરાજી પ્રોવાઇડર ફારા ચકાસાશે. (જે માટે ૨ કામકાજી દિવસો લાગી શકે). પગહું ૩: ઈએમડીની રકમ બીડર ગ્લોબલ ઈએમડી વોલેટમાં જમા કરાવવી. નેક્ટ/ટ્રાન્સફરનો ઉપયોગ કરીને ફંડની ઓનલાઇન એક લાઇન તબદિલી કરવા ઈ હરાજી પ્લેટફોર્મ પર ઓનલાઇન બીડ કરી શકે છે. વેચાણના વિગતવાર નિયમો અને શરાતો માટે બેંકની વેબસાઇટ www.unionbankofindia.co.in પર આપેલ લિંક જોવી.

સિક્ચોરિટી ઇલ્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) બિયમો ૨૦૦૨ના બિયમ ૮(૬) બિયમ ૯(૧) હેઠળ સ્ટેચ્યુટરી ૧૫ દિવસોની વેચાણ માઢેની નોટિસ : આને કથિત ધિરાણ માટેના દેણદાર/રો અને જામીનદાર/રો માટે સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ)નિયમો ૨૦૦૨ના નિયમ ૮(૬)/નિયમ ૯ (૧) મુજબ ઉપર જણાવેલ તારીખે ઈન્હરાજી વેચાણ રાખવા માટેની નોટિસ પણ ગણવી

GOENKA BUSINESS & FINANCE LIMITED

CIN: L67120WB1987PLC042960 REGD. OFF. :- 18, Ranindra sarani, Paddar Court, Gate no.4, Room no.17, Kolkata - 700001, West Bengal

EMAIL: goenkabusiness1987@gmail.com
EXTRACT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH, 2022

PARTICULARS	Quarter Ended 31.03.2022 Audited	Quarter Ended 31.03.2021 Audited	Year Ended 31.03.2022 Audited	Year Ended 31.03.2021 Audited
Total income from operations(net)	25679.53	11,036.70	142034.59	18,649.44
Net Profit/ (Loss) from Ordinary				
Activities after tax	36.94	43.34	59.74	(9.41)
Net Profit/ (Loss) for the period after				
tax (after Extraordinary items)	36.94	43.34	59.74	(9.41)
Equity Share Capital	1,300.01	1,300.01	1,300.01	1,300.01
Reserves (excluding Revaluation				
Reserve as shown in the balance				
sheet of previous year)		-	1,601.56	1,541.91
Earning Per Share (of Rs. 10/-each)				
(Before Extraordinary Items)				
Basic	0.28	0.33	0.46	(0.07)
Diluted	0.28	0.33	0.46	(0.07)
Earning Per Share (of Rs. 10/-each)				
(After Extraordinary Items)				
Basic	0.28	0.33	0.46	(0.07)
Diluted	0.28	0.33	0.46	(0.07)

. The above is an extract of the detailed format of Quarterly/ Annual Financial Results filed with the stock Exchanges under Regulayion 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Quarterely/ Annual Financial Results are available on the stock Exchange website- www.bseindia.com and www.msei.in and on the Company's website www.goenkabusinessfinancelimited.in

The above standalone financial results were reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at their meeting held on May 30, 2022.

On Behalf Of the Board of Director For Goenka Business & Finance Limite

Place: Ahmedabad

Yasin Gor DIN:08221979

MUNOTH CAPITAL MARKET LIMITED

CIN: L99999GJ1986PLC083614

Regd. Office: Shanti Nivas, Opp. Shapath-V, Mr. Karnavati Club, S G Road, Ahmedabad-380058. E-mail address: munoth@gmail.com; Contact No.: 022-22843144, 22870278, 26937954 Audited Standalone financial results for the quarter and year ended 31 March 2022 prepared in accordance with the Indian Accouting Standard (Ind-AS)

Extract of Audited Financial Results for the Quarter/ Year ended 31/03/2022							
	(Rs. In Lakhs except EPS)						
Sr. No.	Particulars	Quarter Ending on 31.03.2022	Year to Date Figures 31.03.2022	Corresponding Three Months Ended in the Previous Year 31.03.2021			
1	Total income from operations (net)	9.40	33.34	2.85			
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	3.55	13.49	-0.54			
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	3.55	13.49	-0.54			
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	3.55	13.49	-0.51			
5	Total Comprehensive income for the period (Comprising Profit for the period (after Tax) and other Comprehensive income (after Tax)	4.56	16.01	2.71			
6	Equity Share Capital	449.55	449.55	449.55			
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year)	0.00	0.00	0.00			
8	Face Value Of Equity Share Capital	5/-	5/-	5/-			
9	Earnings Per Share (before and after extraordinary items) Basic / Diluted:	0.04	0.15	-0.01			
اسا	Jata: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed						

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results file with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and company website For, Munoth Capital Market Limited

Date: 30-05-2022 Shantilal M Jain (Director) DIN: 00370624

RITA FINANCE AND LEASING LIMITED CIN: L67120DL1981PLC011741

Regd Off: 324 A, Illrd Floor, Aggarwal Plaza, Sector-14, Rohini, New Delhi-110085 Email: ritaholdingsltd@gmail.com | Website: www.ritaholdings.in | Tel: 011-45689444

Extracts of the Standalone Audited Financial Results For the Quarter Ended March 31, 2022 (Rs. in Lakh Ended Figures **Particulars** 31/03/2022 31/03/202 (Audited) (Audited) (Audited) 44.66 267.18 I. Total income from operations . Net Profit / (Loss) for the period (before Tax, (21.51)155.66 (12.07)Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax 155.66 (21.51)(12.07)(after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period 116.67 (23.97)(13.37)[Comprising Profit / (Loss) for the period (after (23.97)116.67 (13.37)tax) and other Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year 398.43 398.43 150.70 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -

- The above is an extract of the detailed format of Audited Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirement Regulations, 2015. The full format of the Audited Quarterly Financial Results are available on the Website of the Company i.e. (www.ritafinance.in) and website of the stock Exchange(s)
- . The above result have been reviewed by the audit committee and approved by the Board at the meeting held on 30th May 2022
- 3. The Financial result have been prepared in accordance with the Indian Accounting Standards (Ind-AS) as prescribed under section 133 of the Companies Act ,2013 read with Ind -as rules (As amended).

For and on behalf of the Board of Directors of RITA FINANCE AND LEASING LIMITED

Date: 30.05.2022 Place: New Delhi

PUBLIC ANNOUNCEMENT
INVITATION OF EXPRESSION OF INTEREST FOR SUBMISSION
OF A SCHEME OF COMPROMISE OR ARRANGEMENT FOR
HEMA ENGINEERING INDUSTRIES LIMITED (IN LIQUIDATION) AS PER SECTION 230 OF THE COMPANIES ACT, 2013

HEMA ENGINEERING INDUSTRIES LIMITED (Corporate Debtor) is currently undergoing liquidation

proceedings in terms of provisions of Insolvency and Bankruptcy Code, 2016 ("Code") and Vikas Garg has been appointed as its liquidator pursuant to an order dated 17.05.2022 of Hon'ble National Company Law Tribunal, Court III, New Delhi.

NOTICE is hereby given for inviting proposal for expression of interest from the interested and eligible proposer(s) for submission of scheme of compromise or arrangement under Section 230 of the

RELEVANT PARTICULARS

1. NAME OF CORPORATE DEBTOR | HEMA ENGINEERING INDUSTRIES LTD

2.	Date of Incorporation of Corporate Debtor	22/09/1987			
Authority under which Corporate Debtor is Incorporated/Registered		Registrar of Companies, New Delhi			
4.	Corporate Identity No. / Limited Liability Identification No. of Corporate Debtor				
5.	Address of the registered office & principal office (if any) of Corporate Debtor				
	Begintered Officer Cookindenend Form House Vishengerh Village One Cuimming Deal				

Registered Office: Sachindanand Farm House, Kishangarh Village, Opp. Swimming Pool, DDA Sports Complex, Lane Green Avenue, Vasant Kunj, New Delhi - 110070 Administrative Office (As per MCA Website): 69th Km Stone, Delhi-Jaipur Highway, Dharuhera Rewari – 122001 (Haryana)
Plant: 1/3 KM, Khandsa Road, Gurugram – 122001
Plant: Upparapalli Village, Mathgondapalli Post, Thally Road, Hosur (Tamilnadu)

Plant: No. 713 & 717, Poonapalli Village, Hosur (Taminadu)
Plant: Plot No. 4, Salempur, Mehdood, IP-2, Haridwar (Uttarakhand)
Plant: Khasra No. 1394, Salempur Mehdood-2, Haridwar (Uttarakhand)

Plant: 153, Village Belideyod, Tehsil-Nalagarh (Himachal Pradesh)

Plant: Plot No. 5 & 14, Sector-6, HSIDC, Growth Centre, Bawal Distt. Rewari (Haryana)
Plant: Plot No. G-77, Shed No. 47, SIDCO Industrial Estate, Kakalur, Distt. Thiruvallur-602003 (TN)

Plant: Plot No. 1601, at GIDC Halol, Tal-Halol, Distt. Panchmahal, Gujarat-389350 Plant: 64th Km Stone, Delhi Jaipur Highway, Village Sidhrawli, Gurgaon-122413 Liquidation commencement date

of Corporate Debtor

Date of invitation of expression of interest (EOI) for submission of scheme of compromise or arrangement for compromise or arrangement Vikas Garg Regn No: IBBI/IPA-001/IP-P01050/2017-18/11431 809, 8th Floor, Arunachal Building, Barakhamba Road, New Delhi–110001. Email: vikas@vamindia.in Name, Registration Number and address Correspondence Address/Contact Details and further details can be obtained from Immaculate Resolution Professionals Private Limited Unit No. 122, First Floor, Tower-A, Spazedge Commercial Complex, Sector-47, Sohna Road, Gurgaon – 122018

1. Detailed documents for submission of expression of interest is available on the websit

www.hemaengineering.com.

2. The Liquidator reserves the right to cancel or modify the terms of this advertisement and the process document without assigning any reason and without any liability.

3. The Liquidator reserves the right to withdraw the invitation for submission of Scheme under section 230

and/or change or alter any part thereof at any stage, should it be so necessary at any stage

Scheme of Compromise or Arrangement, if proposed, shall be made by the Applicant on an "As is where is basis", "As is what is basis", "Whatever there is basis" and "No recourse" basis.
 The Liquidator will not be providing any representations or warranties for the Company.

This is not an offer document and is being issued with no commitment. Date: 31.05.2022 Place: Gurugram Vikas Garg (Liquidator) Regn No: IBBI/IPA-001/IP-P01050/2017-18/11431

તારીખ : ૦૧.૦૬.૨૦૨૨, સ્થળઃ ગુજરાત

અધિકૃત અધિકારી, યુનિયન બેંક ઓફ ઈન્ડીયા